



ટાઈફોઇડ

મુસાફરી કરનારાં માટે આરોગ્યને લગતી સલાહ

આ હકીકત પત્રિકા મુસાફરી કરતી વખતે તંદુરસ્ત કેવી રીતે રહેવું અને ટાઈફોઇડ તેમજ પેરાટાઈફોઇડ થતાં કેવી રીતે ટાળવાં તે વિશે વ્યવહારું સલાહ પૂરી પાડે છે.

ટાઈફોઇડ શું છે?

- ટાઈફોઇડ અને પેરાટાઈફોઇડ અટકાવી શકાય તેવા રોગો છે જે સાલમોનેલા નામના બેક્ટેરીયાને કારણે થાય છે.
- ટાઈફોઇડના તાવનાં મુખ્ય અને શરૂઆતનાં ચિહ્નોમાં તાવ, માથાનો દુખાવો, સામાન્ય દુખાવા તેમજ દર્દો, ઉધરસ તેમજ કબજિયાત છે. બાદમાં તમને જાડા થઈ શકે છે, પેટમાં અસ્વસ્થતા લાગે, ભૂખ મરી જાય તેમજ ઉલટી થવા જેવું લાગી શકે છે.
- જો તેનો ઈલાજ કરવામાં ન આવે, તો તેના કારણે ગંભીર બીમારી અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે.
- તે માત્ર ટાઈફોઇડની રસી લઈને પણ અટકાવી શકાય છે, જે તમે મુસાફરી કરો તે પહેલાં તમારા જીપી પાસેથી અથવા તો તમે જ્યારે વિદેશમાં હો ત્યારે કોઈ સારી આરોગ્ય સંસ્થા પાસેથી તમે મેળવી શકો છો.

ટાઈફોઇડ ક્યાં જોવા મળે છે?

- ટાઈફોઇડ આખા વિશ્વમાં થાય છે, પરંતુ યુકેમાં થતા મોટા ભાગના કેસો પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ભારતથી અથવા આફ્રિકાના અમુક ભાગોમાંથી પાછાં ફરેલાં મુસાફરોના હોય છે.
- યુકેમાં દર વર્ષ આ દેશોમાંથી તાજેતરમાં પાછાં ફરેલાં લોકોમાંથી લગભગ 500 કેસો નોંધાય છે, અને આમાંનાં લગભગ અડ્ધા ભાગના કેસો લંડનમાંથી નોંધાય છે.

ટાઈફોઇડ કોને થાય છે?

- યુકેમાં ટાઈફોઇડ અને પેરાટાઈફોઇડ થયો હોય તેવાં મોટાભાગનાં લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ભારતથી મુસાફરી કરીને પાછાં આવેલાં લોકો છે.
- મોટાભાગના કેસો પાકિસ્તાની, બાંગ્લાદેશી અથવા ભારતીય મૂળનાં એવાં લોકોના છે જેઓ મિત્રો અને સગાંની મુલાકાતે ગયાં હતાં.
- જો તમે ભારત, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશની અગાઉ મુસાફરી કરેલી હોય, અને જો તમે છેલ્લાં ગ્રાન્ટ વર્ષમાં ટાઈફોઇડની રસી ન લીધી હોય, તોયે હજુ પણ તમને ટાઈફોઇડ થઈ શકે છે.

ટાઈફોઇડ કેવી રીતે પકડાય છે?

- ટાઈફોઇડ અને તેની સાથે જોડાયેલ પેરાટાઈફોઇડની બીમારી એવા ખોરાકી પદાર્થો કે પીણાં લેવાથી થાય છે જે ટાઈફોઇડના બેક્ટેરીયાથી પ્રદૂષિત થયેલાં હોય.
- ખોરાક કે પીણાં કદાચ દેખાવમાં ચોખાં લાગે, પરંતુ તેમાં ટાઈફોઇડના બેક્ટેરીયા હોઈ શકે છે.
- ટાઈફોઇડનું જાડા (મળ)માં વહન થાય છે. જ્યારે કોઈ ગંદા હાથ વડે ખોરાક અથવા પીણાંને અડે છે, અથવા તેના પર માખી બેસે છે ત્યારે તેનાથી ખોરાક અને પીણાં પ્રદૂષિત થઈ શકે છે.
- જ્યારે ચોખાઈ માટેનાં પૂરતાં નિયંત્રણો અમલમાં ન હોય ત્યારે પાણીમાં ગાંદકી મિશ્ર થઈને તે પ્રદૂષિત થઈ શકે છે.
- જો પ્રદૂષિત પાણીમાંથી મેળવવામાં આવી હોય તો શેલફિશ (ધીપલાં માછલી) પણ પ્રદૂષિત થઈ શકે છે.

તમે મુસાફરી કરો ત્યારે ટાઈફોઇડ થતાં કેવી રીતે અટકાવશો?

- તમે મુસાફરી કરવાનાં હો તેનાં ઓછામાં ઓછાં બે અઠવાદિયાં પહેલાં તમારા જીપીને મળીને પૂછી જુઓ કે તમારે ટાઈફોઇડની રસી લેવાની જરૂર છે કે કેમ.
- જો તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ભારતમાં જન્મેલાં અને ઉછરેલાં હો, અથવા તમે અગાઉ ત્યાં ગયેલાં હો, તો પણ તમે મુસાફરી કરો તે પહેલાં તમારે કદાચ ટાઈફોઇડની રસી લેવાની જરૂર પડી શકે. આ રસી લગભગ ત્રણ વર્ષ સુધી તમારું રક્ષણ કરે છે.
- પેરાટાઈફોઇડ ઈન્ફેક્શન સામે કોઈ રસી ઉપલબ્ધ નથી, આથી તમે શું ખાઓ અને પીઓ છો તેનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. યાદ રાખો:
ઉકાળો, રાંધો, છાલ ઉતારો અથવા તો ભૂલી જાવ!
- તાજો તૈયાર કરવામાં આવેલો, રાંધેલો અને પરપોટા નીકળો એટલો ગરમ ખોરાક હોય તે જ અથવા તમે જાતે જ છોલ્યાં હોય તેવાં, જેમ કે કેળાં અને કેરી જેવાં ફળો જ ખાવ.
- માત્ર બાટલીમાં બરેલું, ઉકાળીને ઠંકું પાઢેલું પાણી અથવા પેશ્વરાઈઝ (ઉકાળીને જીવાણું રહિત કરેલું) દૂધ જ પીવો. બાટલીમાં બરેલું પાણી પીતી વખતે, ખાતરી કરો કે તેનું સીલ તૂટેલું ન હોય અથવા વાયુના પરપોટા નીકળતું (સ્પાર્કલિંગ) પાણી જ પીવો જેથી તે બાટલી ફરીથી ભરવામાં નથી આવી તેની ખાતરી રહે.
- સાબુ અને પાણી વડે તમારા હાથ વારંવાર ધૂંઘૂંા.
- ખોરાક બનાવતાં પહેલાં, ખાતાં કે પીતાં પહેલાં અને ટોઈલેટ વાપર્યા પછી તમારા હાથ ધૂંઘૂંા.
- તમારા દાંત ઘસવા માટે બાટલીનું અથવા ઉકાળેલું પાણી વાપરો. નળમાંથી આવતું પાણી વાપરશો નહિ.

તમારે આ ન લેવું જોઈએ:

- રાંધ્યા વગરનો ખોરાક, જેમ કે સેલાડ (કચુંબર).
- કાચી અથવા રાંધ્યા વગરની શેલફિશ.
- બદ્દ ભોજન (જો તમારે બદ્દ ભોજન લેવું જ પડે તેમ હોય, તો ત્યાં વરાળ નીકળતી હોય તેવી ગરમ વાનગીઓ જ પસંદ કરો)
- પેશ્વરાઈઝ ન કર્યું હોય તેવું (કાચું) દૂધ અને ચીજા.
- બરફના ચોસલાં (પીણાં ઠંડાં રાખવા માટે તેનું આખું ઉબલું અથવા ગ્લાસ બરફ પર મૂકી, પરંતુ બરફ તમારા પીણાંમાં ઉમેરશો નહિ).
- નળનું પાણી.
- આઈસ-કીમની બનાવટો.
- રેસ્ટોરેન્ટ્સમાં ઠંડી ગળી વાનગીઓ (ડિઝર્ટ્સ)
- આગલા દિવસનો વધેલો ખોરાક.

શું આ બીમારીનો ઈલાજ કરી શકાય છે?

- હા. ટાઈફોઇડનો ઈલાજ તમારા જીપી દ્વારા આપવામાં આવતી એન્ટિબાયોટિક્સ વડે કરી શકાય છે.
- જો ટાઈફોઇડનો ઈલાજ કરવામાં ન આવે, તો તે યુકેમાં રહેતાં કુટુંબનાં સત્યોમાં તેમજ સંપર્કમાં આવતાં બીજાં લોકોમાં ફેલાઈ શકે છે.
- તમે વિદેશમાં હો ત્યારે અથવા યુકેમાં પાણીં આવી ગયાં પછી જો તમને ટાઈફોઇડના તાવનાં ચિહ્નો અને નિશાનીઓ સાથે અસ્વસ્થતા લાગતી હોય, તો ડોક્ટરને મળો અથવા તમારી નજીકની હોસ્પિટલના એક્સિસેન્ટ એન્ડ ઈમર્જન્સી વિભાગમાં જાવ.

મુખ્ય મુદ્દા

- વિદેશમાં ભિત્રો અને સગાંને મળવા ગયાં હો ત્યારે તમને ટાઈફોઇડ લાગે તેવું જોખમ છે.
- જો તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા ભારતમાં જન્મેલાં અથવા રહેલાં હો, તો પણ તમે જ્યારે આ દેશોમાં ફરવા માટે જાવ ત્યારે તમને ટાઈફોઇડ લાગી શકે તેવું જોખમ રહેલું છે.
- તમે મુસાફરી કરો તે પહેલાં ટાઈફોઇડની રસી લેવા માટે તમારા જીપીને મળો અથવા ટ્રાવેલ ક્લિનિકમાં જાવ.
- વિદેશમાં હો તે દરમ્યાન તમારા હાથ તેમજ ખોરાકી સ્વચ્છતા માટે સાવધ રહો - ખાતાં પહેલાં અને ટોઈલેટ વાપર્યા પછી સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલ્યુક્ટ જેલ વડે તમારા હાથ ધૂંઘૂંા.
- તમારા જીપી દ્વારા આપવામાં આવતી એન્ટિબાયોટિક્સ વડે ટાઈફોઇડનો ઈલાજ કરી શકાય છે.
- જો ટાઈફોઇડનો ઈલાજ કરવામાં ન આવે તો તે યુકેમાં રહેતાં કુટુંબનાં સત્યોમાં તેમજ સંપર્કમાં આવતાં બીજાં લોકોમાં ફેલાઈ શકે છે.
- તમે વિદેશમાં હો ત્યારે અથવા યુકેમાં પાણીં આવી ગયાં પછી જો તમને ટાઈફોઇડના તાવનાં ચિહ્નો અને નિશાનીઓ સાથે અસ્વસ્થતા લાગતી હોય, તો ડોક્ટરને મળો અથવા તમારી નજીકની હોસ્પિટલના એક્સિસેન્ટ એન્ડ ઈમર્જન્સી વિભાગમાં જાવ.